

સરકારી આવાસોનાં ભાડાનાં દર નક્કી કરવા બાબત

ગુજરાત સરકાર

માર્ગ અને મકાન વિભાગ

ઠરાવ ક્રમાંક: એસીડી/૧૦/૨૦૧૩/૯૯૮/૪૧/ન-૧.

૧૪/૩, સરદાર ભવન, સચિવાલય, ગાંધીનગર

તા. ૩૧/૦૧/૨૦૧૫

- સંદર્ભ : (૧) મા.મ.વિ.નો ઠરાવ ક્રમાંક: એસીડી/૧૧૯૭/૧૫૮૭/૫૮/ન-૧. તા. ૯/૬/૧૯૯૮
(૨) મા.મ.વિ.નો ઠરાવ ક્રમાંક: એસીડી/૧૧૯૭/૧૫૮૭/૫૮/ન-૧. તા. ૧/૧૦/૧૯૯૮
(૩) નાણા વિભાગનાં નોટીફિકેશન ક્રમાંક: (GN-8) PGR - 1009 -2-Pay Cell (M).
તા. ૨૭/૨/૨૦૦૯

આમુખ :

રાજ્ય સરકારે પાંચમા પગાર પંચનાં પગારધોરણોને ધ્યાનમાં લઈને સરકારી આવાસનાં માસિક ફ્લેટ રેટ , સ્ટાન્ડર્ડ રેટ , ઇકોનોમી રેટ અને માર્કેટ રેટનાં સુધારેલ દરો ઉપર સંદર્ભ (૧) આગળનાં ઠરાવથી અમલી બનાવેલ. આ દરો ઘણા જુના હોઈ અને ઉપર વંચાણે લીધા ક્રમાંક: (૩) આગળનાં નોટીફિકેશન અન્વયે હાલમાં છઠ્ઠા પગારપંચ મુજબનાં પગારધોરણો અમલમાં હોઈ સરકારી રહેણાંકનાં દરો નવેસરથી સુધારવાની બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી. કાળજીપૂર્વકની વિચારણાને અંતે સરકારશ્રીએ નીચે મુજબ નિર્ણય કરેલ છે.

ઠરાવ :

સરકારી આવાસો સરકારી કર્મચારી/અધિકારીઓને રહેણાંકનાં હેતુ માટે ફાળવવામાં આવે છે. સંદર્ભ (૧) આગળ દર્શાવેલ તા. ૯/૬/૧૯૯૮નાં ઠરાવથી સરકારી આવાસનાં ભાડાનાં જે દરો નિયત કરવામાં આવેલ હતા તે પાંચમા પગારપંચનાં પગારધોરણોને અનુરૂપ અને ઘણા જુના હોઈ સુધારવા જરૂરી હતા. સરકારી કર્મચારી/અધિકારીઓની બદલી/નિવૃત્તી/ચાલુ કરજો દરમિયાન અવસાન / નિયત મુદત માટે ફાળવેલ આવાસની મુદત પૂર્ણ થયા બાદ સરકારી આવાસો ખાલી કરવામાં આવતાં નથી અને તેનો બિનઅધિકૃત કબજો-ભોગવટો ચાલુ રાખવામાં આવે છે. આ સંજોગોમાં બિનઅધિકૃત સમયનું ભાડું વસુલ કરવા માટે ધોરણસરનું ભાડું (સ્ટાન્ડર્ડ રેટ) , આર્થિક ભાડું (ઇકોનોમી રેટ) તથા બજાર ભાડું (માર્કેટ રેટ) નક્કી કરવું જરૂરી છે. આથી ભાડાની ગણતરી, વસુલાત માટે નીચે મુજબનાં દરો આથી ઠરાવવામાં આવે છે.

INWARD NO. ૧૩
DATE. ૧૪/૧૫
Executive Engineer,
A.A.U., ANAND.

Office of the Registrar
A. U., ANAND.
31 MAR 2015

૩૪૧/મ.૩
૧૧/૧૬/૧૫